

+

ફાઈલનું નામ - BA00S003 . GCO

પુસ્તકનું નામ - નાણાં અને બેંકિંગ

લેખક - જી . પી . મલમપટ્ટાવાળા

પ્રથમ આવૃત્તિ : - ૧૯૮૨

પ્રકાશક - ગુજરાત યુનિવર્સિટી , અમદાવાદ - ૯

મળવાનું ઠેકાણું - D . O . E .

વિભાગ - COMMERCE

ઉપવિભાગ - BANKING

કિંમત - રૂ . ૮ . ૦૦

શબ્દ -

નાણાં અને બેંકિંગ

૨ . નાણાંનો પુરવઠો અને બેંકિંગ વ્યવસ્થા

પાન નં ૧૨

૧ . નાણાંપુરવઠાના સિદ્ધાંતની જરૂરિયાત :

નાણાની માગણી સરખામણીમાં નાણાંના પુરવઠાનો સિદ્ધાંત તૈયાર કરવા પાછળ અર્થશાસ્ત્રીઓએ ઓછું ધ્યાન આપ્યું છે અને ઓછો સમય ખર્ચ્યો છે . ભૂતકાળમાં અનેક દેશોમાં લાંબા સમય સુધી સુવર્ણઘોરણ પ્રચલિત હતું . સુવર્ણ ઘોરણ હેઠળ નાણાંપુરવઠાને અસર કરતાં પરિબળોનું વિશ્લેષણ અગત્યનું ગણાય નહિ .

પરંતુ જ્યારે વેપારીબેંકોની ચાલુ થાપણોનો નાણાં તરીકે ઉપયોગ થયો , વેપારી બેંકોમાં અંશતઃ રોકડ અનામત પદ્ધતિ અમલમાં આવી અને વેપારીબેંકોના નિયંત્રણ માટે મધ્યસ્થ બેંકની સ્થાપના થઈ ત્યારે નાણાંના પુરવઠામાં પેરફાર લાવતાં પરિબળની વ્યવસ્થિત સમજૂતીની જરૂરિયાતો ઊભી થઈ અને નાણાં - પુરવઠાનો સિદ્ધાંત રચવાની દિશામાં પ્રયાસો થયા . નાણાંપુરવઠાના આધુનિક સિદ્ધાંતમાં તમામ નિર્ણાયક પરિબળોનું ચોક્કસ સમીકરણ દ્વારા નિરપૂર્ણ કરવામાં આવે છે . નાણાં પુરવઠો નક્કી કરવામાં વેપારી બેંકો , મધ્યસ્થ બેંક , સરકાર અને લોકો શો ભાગ ભજવે છે એની એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે .

૨ . વેપારીબેંકોના દેણાંનું મુદ્રીકરણ :

ધીરધાર કરતી અન્ય સંસ્થાઓથી વેપારી બેંકો એક મહત્વની બાબતમાં અલગ પડી જાય છે . તેમનાં દેણાંનો કેટલોક ભાગ (અર્થાત ચાલુ થાપણો) વિનિમય માધ્યમ વર્ગ તરીકે કાર્ય કરે છે . આથી વેપારીબેંકો લોન આપીને કે જામીનગીરી જેવી અસ્કામતો ખરીદીને પોતાનાં દેણાં વધારે ત્યારે નાણાંના પુરવઠામાં વધારો થાય છે . દા . ત . , ક્ષ વ્યક્તિ ય વ્યક્તિ પાસેથી પ્રોમેસરી નોટના આધારે ૯૦૦ રૂ . ની લોન લે તો અર્થતંત્રમાં નાણાનો કુલ પુરવઠો યથાવત રહે છે . કારણ કે આ લોનને પરિણામે ક્ષ પાસે ૯૦૦ રૂ . આવે છે અને ય પાસે પ્રોમેસરી નોટ આવે છે , જે નાણું નથી . હવે ધારો કે ય વ્યક્તિ પાસે ૧૦૦૦ રૂ . વેપારી બેંકમાં ચાલુ થાપણ સ્વરૂપમાં મૂકે છે . થાપણદારો

પાન નં ૧૩

ગમે ત્યારે પોતાની થાપણ સ્વરૂપમાં ઉપાડી શકે છે . તથેથી તેમની માગણી સંતોષવા માટે વેપારીબેંકોએ ચલનીનાણાંના સ્વરૂપમાં અનામત રાખવી પડે છે . જે રોકડ અનામત કહેવાય છે . પણ બધા થાપણદારો એક સાથે ઉપાડ કરતા નથી . ઉપરાંત એક તરફ જૂના થાપણ દારોમાંથી કેટલાક નાણું ઉપાડે છે તો બીજી તરફ એ જ સમયકેટલીક વ્યક્તિઓ બેંકમાં નાણું મૂકવા આવે છે . આથી વેપારીબેંકો કુલ થાપણનો અમુક ભાગ રોકડ અનામત તરીકે રાખે છે અને વ્યાજ કમાવવાના હેતુથી બાકીના ભાગનું ધીરાણ કરે છે કે એના વડે અકસ્માતોની ખરીદી કરે છે . ધારો કે વેપારીબેંક ય વ્યક્તિની ૧૦૦૦ રૂ . ની ચાલુ થાપણમાંથી ૧૦૦ રૂ અનામત રાખે છે અને ક્ષ વ્યક્તિને ૯૦૦ રૂ . ની લોન આપે છે . હવે ય વ્યક્તિ પાસે ચાલુ થાપણના સ્વરૂપમાં ૧૦૦૦ રૂ . છે અને ક્ષ વ્યક્તિ પાસે ચલણીનાણાંના સ્વરૂપમાં ૯૦૦ રૂ . છે . આમ , નાણાંના પુરવઠામાં ૯૦૦ રૂ . નો વધારો થાય છે .

૩ . કોઈ એક વેપારી બેંક દ્વારા બેકથાપણોનું સર્જન :

વાસ્તવમાં કોઈ એક વેપારીબેંકમાં ૧૦૦૦ રૂ . નવી થાપણ આવે ત્યારે નાણાપુરવઠામાં અનેક ગણો વધારો થાય છે . એનાં બે કારણો છે : પ્રથમ , થાપણોનો અમુક જ ભાગ રોકડ અનામત સ્વરૂપમાં રાખવામાં આવે છે . બીજું , વેપારી બેંકે લોન દ્વારા કે જામીનગીરી ખરીદીને આપેલી રકમ એ જ બેંકમાં કે અન્ય બેંકમાં પાછી ફરે છે .

આ મુદ્દો સમજવા માટે આપણે માની લઈએ કે દેશમાં એક જ વેપારી બેંક છે . ચાલુથાપણો અની જવાબદારીઓ છે . ચાલુથાપણો સામે વેપારીબેંક

સાચવેલી રોકડઅનામત તેમ જ લોકોને એણે આપેલું ધીરાણ એની અસ્કામતો છે . લોકો માત્ર ચાલુથાપણોના સ્વરૂપમાં પોતાની પાસે નાણું રાખે છે ; જો તેમને ચલણીનાણું મળે તો તે વેપારીબેંકમાં પોતાના ચાલુખાતામાં તુરત જમા કરાવી દે છે . |નું ઇસ્થિત રોકડ અનામત પ્રમાણ ૧૦ ટકા છે . વેપારી બેંક સમતુલાની સ્થિતિમાં છે , એટલે કે એની પાસે જરૂર કરતા વધુ કે ઓછી રોકડ અનામત નથી ; ઇસ્થિત અને વાસ્તવિક રોકડઅનામતનું પ્રમાણ સરખું છે .

સરળતાનો ખાતર ધારોકે સરકાર નવી નોટોનું સર્જન કરે ને કોઈ એક વ્યક્તિ અ ને આવકવેરાના રીફંડ પેટે ૧૦૦ રૂ . આપે છે અને અ વ્યક્તિ એ રકમ બેંકમાં જમા કરાવે છે . બેંકમનું સરવૈયું નીચે મુજબ હશે .

અસ્કામતો જવાબદારીઓ
રોકડઅનામત ૧૦૦ ચાલુ થાપણ ૧૦૦

પાન નં ૧૪

બેંકની અસ્કામતો અન જવાબદારીઓમાં ૧૦૦ રૂ . નો વધારો થાય છે . પરંતુ ૧૦૦ રૂ . નવી ઝથાપણ સામે ૧૦ રૂ . ની રોકડઅનામત પૂરતી છે . આથી વ્યાજની આવક કરવા માટે , ધારો કે બેંક ક્ષ નામની વ્યક્તિને ૮૦ રૂ . ની લોન આપે છે ક્ષ વ્યક્તિને તે નોટોના સ્વરૂપમાં ૮૦ રૂ . આપી શકે છે , પણ લોકો ચાલુ થાપણોનો ઉપયોગ જ પસંદ કરે છે . તેથી બેંકમાં આ લોનને પરિણામે ક્ષના કાતામાં ૮૦ રૂ . જમા થશે અને બેંકનું સરવૈયું હવે નીચે મુજબ હશે .

અસ્કામતો જવાબદારીઓ
રોકડઅનામત ૧૦૦ ચાલુ થાપણો ૧૮૦
ક્ષને લોન ૮૦ (અ ની ૧૦૦ વત્તા ક્ષની ૮૦)

૧૮૦ રૂ . ચાલુથાપણો સામે ૧૮ રૂ . ની રોકડઅનામત પૂરતી ગણાય . પણ બેંક પાસે ૧૦૦ રૂ . ની રોકડઅનામત છે . આથી બેંકમાં ૧૦૦ - ૧૮ બરાબર ૮૨

૩ . ની વધારાની રોકડઅનામત છે . ધારો કે બેંક હવે ય વ્યક્તિને ૮૨ રૂ . ની લોન

આપે છે . પરિણામે બેંકના સરવૈયામાં નીચે મુજબ ફેરફાર થશે .

અસ્કામતો જવાબદારીઓ
રોકડઅનામત ૧૦૦ અ , ક્ષ , યની ચાલુથાપણો ૨૭૨

ક્ષ અને યને (૧૦૦ વત્તા ૯૦ વત્તા ૮૧
આપેલી લોન ૧૭૧
(૯૦ વત્તા ૮૧)

હજી બેંકમાં ૭૨ . ૯૦ રૂ . ની વધારાની રોકડઅનામત છે . જો બેંક મ નામની વ્યક્તિને ૭૨ . ૯૦ રૂ . ની લોન આપી તેના ખાતામાં એ રકમ જમા મૂકે તો પણ

બેંક પાસે ૬૫ . ૬૧ રૂ . ની વધારાની * રહેશે આથી બેમક કોઈ એક

ન વ્યક્તિ ૬૫ . ૬૧ રૂ . ની લોન આપશે .

એમ કરતાં રોકડ અનામતનું અતિરિક્તપ્રમાણ ક્રમશઃ ઘટતું જશે , અને ઘટીને શૂન્ય થાય ત્યારે થાપણ તેમજ લોનના વિસ્તારની પ્રક્રિયા અંત પામશે . છેવટે બેંકથાપણોમાં એટલો વધારો થયો હશે કે જેથી બેંકે મેળવેલી નવી રોકડ

અનામત (૧૦૦ રૂ) જેટલી રોકડઅનામત રાખવાની જરૂરિયાત ઊભી થાય અર્થત્વા રોકડઅનામત અને ઈસ્થિત * (10 %) બંને

પાન નં ૧૫

સરખા થાય ત્યાંકે થાપણ તેમજ લોનના વિસ્તારની પ્રક્રિયાનો અંત આવશે . સમીકરણના સ્વરૂપમાં મૂકીએ તો ,

ઉપરના ઉદાહરણમાં બેંકથાપણોનો વધારો નવી રોકડઅનામતના ૧૦ ગણા જેટલો થાય ત્યારે વિસ્તારની પ્રક્રિયા થંભી જશે . કારણ કે

સમતુલાની સ્થિતિમાં વેપારીબેંકના સરવૈયાનું સ્વરૂપ નીચે મુજબ હશે .

અસ્કામતો જવાબદારીઓ

* 100 ચાલુ થાપણો

કુલ લોન ૯૦૦ અ ની ૧૦૦

ક્ષને ૯૦ ક્ષ ની ૯૦

ય ને ૮૧ ય ની ૮૧

મ ને ૭૨ . ૯૦ મ ની ૭૨ . ૯૦

ન ને ૬૫ . ૬૧ ન ની ૬૫ . ૬૧

વગેરે વગેરે

અહીં , બેંકથાપણોમાં થયેલો કુલ વધારો ૧ , ૦૦૦ રૂ . છે જ્યારે બેંક - ધીરાણમાં થયેલો કુલ વધારો ૯૦૦ રૂ . છે . એ બંનેનો તફાવત (૧૦૦ રૂ .)

અ

વ્યક્તિએ મૂકેલી પ્રારંભિક થાપણ બરાબર છે . સ્પષ્ટ થાય છે કે બેંકથાપણનો ગુણક * પ્રમામના વ્યસ્ત બરાબર હોય છે . જ્યારે બેંકધીરાણનો ગુણક પ્રમાણના વ્યસ્ત ઓછા એક બરાબર હોય છે . (અનુક્રમે $1/0.1 =$ અને $10 - 1 = 9$) .

પાન નં ૧૬

૪ . અનેક વેપારીબેંક દ્વારા બેંકથાપણનો સર્જન :

દેશોમાં અનેક વેપારીબેંકો હોય અને કોઈ એક બેંક આપેલી લોનની રકમ અન્ય બેંક કે બેંકોમાં જમા કરાવવામાં આવતી હોય તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી . આ મુદ્દો પણ ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરીએ

ધાકો રે વેપારી બેંકમાં ઈચ્છિત * પ્રમાણ ૧૦ ટકા છે અને દરેક વેપારીબેંક સમતુલાની સ્થિતિમાં છે . હવે ધારો કે વ્યક્તિ અ ૩ . ૧૦૦ ની રોકડ રકમ બેંક Aમાં જમા કરાવે છે . આથી A બેંકમાં ૮૦ રૂ . ની વધારાની * અસ્તિત્વમાં આવે છે . આથી A બેંક ક્ષ નામની વ્યક્તિને ૮૦ રૂ . ની લોન આપે છે . A બેંકનું સરવૈયું નીચે મુજબ હશે .

અસ્કામતો જવાબદારીઓ
રોકડ અનામત ૧૦૦ થાપણો ૧૮૦
ક્ષને લોન ૮૦ (અ ની ૧૦૦ વત્તા ક્ષની ૮૦)

ધારો કે ક્ષ વ્યક્તિ B બેંકની ખાતેદાર છે . આથી તે B બેંકમાં પરોતાના ખાતામાં ૮૦ રૂ . ચેક દ્વારા જમા કરાવે છે . B બેંક જ્યારે A બેંક પરનો ૮૦ રૂ . નો ચેક વડાવે ત્યારે A બેંક B બેંકનું સરવૈયું નીચે મુજબ હશે .

A બેંક

અસ્કામતો જવાબદારીઓ
* 10 અ ની થાપણ ૧૦૦
ક્ષ ને લોન ૮૦

B બેંક

અસ્કામતો જવાબદારીઓ
રોકડ અનામત ૮૦ ક્ષની થાપણ ૮૦

હવે B બેંક પાસે ઈચ્છિત * કરતાં વાસ્તવિક *
૮૧ રૂ . જેટલી વધુ છે . આથી તે ય વ્યક્તિને ૮૧ રૂ . ની લોન આપશે ય
વ્યક્તિ

આ રકમ પોતાની બેંક C માં મૂકે અને C બેંક B બેંકમાંથી આ રકમ ઉપાડી
લે તો B બેંક અને C બેંકના સરવૈયા સ્વરૂપ નીચે મુજબ હશે .

B બેંક

અસ્કતામતો જવાબદારીઓ

* 9 લાખ ની થાપણ ૮૦

ય ને લોન ૮૧

પાન નં ૧૭

C બેંક

અસ્કામતો જવાબદારીઓ

રોકડ અનામતો ૮૧ ય ની થાપણ ૮૧

હવે C બેંકમાં ૭૨ . ૮૦ રૂ . ની વધારાની * છે . આથી તેટલી
રકમનું તે ધીરાણ કરશે , જે અન્ય કોઈ બેંકમાં જમા થશે . આમ , * નો
પ્રારંભિક વધારો (૧૦૦ રૂ .) અનેક વેપારીબેંકો વચ્ચે વહેંચાઈ જશે . દરેક
વેપારીબેંકમાં * , લોન તથા થાપણમાં થયેલો વધારો કોઠાના સ્વરૂપમાં
નીચે મુજબ દર્શાવી શકાય છે .

બેંક રોકડઅનામતમાં લોનમાં થાપણમાં
વધારો વધારો વધારો

A 10 રૂ . ૮૦ રૂ . ૧૦૦ રૂ .

B 9 રૂ . ૮૧ રૂ . ૮૦ રૂ .

C 8 . 10 રૂ . ૭૨ . ૮૦ રૂ . ૮૧ રૂ .

D 7 . 29 રૂ . ૬૫ . ૬૧ રૂ . ૭૨ . ૮૦ રૂ .

કુલ વધારો ૧૦૦ રૂ . ૮૦૦ રૂ . ૧ , ૦૦૦ રૂ .

આ ઉદાહરણમાં પણ બેંકકથાપણોનો કુલ વધારો રોકડઅનામતના પ્રારંભિક

વધારાથી દસ ગણો છે , કેમકે અહીં પણ ઈચ્છિત રોકડઅનામત પ્રમાણ ૧૦ ટકા છે .

૫ . ચલણી નાણાંનું બહિર્ગમન :

વાસ્તવમાં લોકો બધું નાણું ચાલુ થાપણોના સ્વરૂપમાં રાખતા નથી . કેટલીક ખરીદી માટે ચલણી માણું વધુ અનુકૂળ છે , આથી તેઓ કેટલુંક ચલણી નાણું પણ રાખવાનું પસંદ કરે છે . બેંકથાપણોના વિસ્તારની પ્રક્રિયા પર લોકોની આ પસંદગીની કેવી અસર પડે છે એ તપાસીએ .

ધારો કે લોકો ૩ . દીઠ ચાલુપણની સામે ૩૦ પૈસા ચલણીનાણાંના સ્વરૂપમાં રાખવા માગે છે . અર્થાત્ ચલણીનાણું અને ચાલુથાપણોનો ગુણોત્તર ૦ . ૩ છે . આ પરિસ્થિતિમાં અ વ્યક્તિ સરકાર તરફથી મળેલી ૧૦૦ રૂ . ની રોકડ રકમ A નામની વેપારી બેંકમાં પૂરેપૂરી મુકશે નહિ . એમાંથી ૭૭ રૂ . પોતાની

પાન નં ૧૮

બેંકમાં ચાલુ થાપણ તરીકે મૂકશે અને ૨૩ રૂ . રોકડ સ્વરૂપમાં પોતાની પાસે

રાખશે , કારણ કે $૨૩ / ૭૭ = ૦ . ૩$. આથી વેપારી બેંકની જવાબદારીઓ (થાપણો) માં

૭૭ રૂ . નો વધારો થશે ; તેની અસ્કામતોમાં રોકડઅનામત ૭ . ૭૦ રૂ . અને લોન

૯૮ . ૩૦ રૂ . જેટલી વધશે .

ધારો કે A બેંકે ક્ષ વ્યક્તિને ૯૮ . ૩૦ ની લોન આપી છે . ક્ષ વ્યક્તિ એમાંથી લગભગ ૧૬ રૂ . ચલણીનાણાંનાં સ્વરૂપમાં રાખશે અને ૫૩ . ૩૦ રૂ .

પોતાની બેંક B માં ચાલુ ખાતામાં જમા કરાવશે . આમ , દરેક તબક્કે લોન અને

થાપણમાં થતો વધારો , અગાઉની પરિસ્થિતિ જેમાં લોકો માત્ર ચાલુ થાપણોના સ્વરૂપમાં નાણું રાખે છે તેના સરખામણીમાં ઓછો છે . આથી થાપણોનો કુલ વધારો પણ અગાઉની સરખામણીમાં ઓછો હોય એ સ્વાભાવિક છે .

પાન નં ૧૯

૭ . મુદતી થાપણો :

લોકો પોતાનું નાણું વેપારીબંકોમાં ચાલુ થાપણ તરીકે અથવા મુદતી થાપણના સ્વરૂપમાં મૂકી શકે છે . ચાલુથાપણ વિનિમયના માધ્યમ તરીકે ઉપ - યોગી છે , પણ એના પર વ્યાજની આવક મળતી નથી . જ્યારે મુદતી થાપણો

પાન નં ૨૦

વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગી નથી , પણ વ્યાજ આપે છે . આથી લોકો પોતાની રકમ ચાલુથાપણમાંથી ઉપાડીને મુદતી થાપણમાં મૂકે તો નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે તે જાણવું જોઈએ .

મુદતી થાપણોના અસ્તિત્વની નાણાંપુરવઠા પર બે અસરો ઉલ્લેખનીય છે

પ્રથમ , નાણાંના પુરવઠામાં મુદતી થાપણોનો સમાવેશ થતો નથી . આથી જેટલા પ્રમાણમાં ચાલુ થાપણોનું મુદતી થાપણોમાં પરિવર્તન થાય તેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો ઘટી જશે . બીજું , વેપારીબંકો મુદતીથાપણો સામે રોકડઅનામત રાખે છે . અલબત્ત , ચાલુથાપણો સામે જે રોકડઅનામત પ્રમાણ રાખવામાં આવે છે એની સરખામણીમાં મુદતીથાપણો સામે રોકડઅનામત પ્રમાણ ઓછું હોય છે . તેમ છતાં , લોકો મુદતીથાપણનો અને ચાલુથાપણનો

ચોક્કસ ગુણોત્તર જાળવી

રાખે છે એમ આપણે માની લઈએ તો બેંકથાપણના ગુણકનું મૂલ્ય ઘટી જશે .

એટલે કે ૧૦૦ રૂ . ના નાણાંસર્જનને પરિણામે સમીકરણ (૮) મુજબ બેંકથાપણમાં

(અથવા નાણાંપુરવઠામાં) જેટલો વધારો થાય છે એની સરખામણીમાં હવે બેંકથાપણનો વધારો ઓછો હશે .

ધારો કે વેપારીબંકોમાં ચાલુથાપણો (D) સામે રોકડઅનામત પ્રમાણ (rD)

૦ . ૧ છે ; મુદતીથાપણો (T) સામે રોકડઅનામત પ્રમાણ (rT) ૦ . ૦૫ છે .

લોકો

રૂપિયાદીઠ ચાલુથાપણ સામે ૦ . ૩ ચલણીનાણું અને ૦ . ૬ મુદતીથાપણ રાખે છે .

એટલે કે ચલણીનાણું અને ચાલુથાપણનો ગુણોત્તર (c') ૦ . ૩ છે , જ્યારે મુદતી

થાપણો અને ચાલુથાપણોનો ગુણોત્તર (t) ૦ . ૬ છે . અગાઉની જેમ વેપારીબંકોમાં

અતિરિક્ત રોકડઅનામત પ્રમાણ (e) ૦ . ૦૫ છે એમ માની લઈએ તો સરકાર દ્વારા નાણાંસર્જનને પરિણામે વેપારીબંકોની રોકડઅનામતમાં ૧૦૦ રૂ . નો વધારો થતાં ચાલુથાપણોમાં ૨૦૮ . ૩૩ રૂ . વધારો થશે .

પાન નં ૨૧

૮ . સરકારની થાપણો :

સરકાર દેશની મધ્યસ્થબેંકમાં તેમ જ વેપારીબેંકોમાં પોતાની થાપણો મૂકે છે . પણ નાણાંના પુરવઠામાં સરકારની થાપણોનો સમાવેશ થતો નથી , માત્ર લોકોનાં ચલનીનાણાં અને લોકોની ચાલુથાપણોનો સમાવેશ થાય છે . આથી લોકો જ્યારે કરવેરાની ચુકવણી કરે ત્યારે વેપારીબેંકોમાં લોકોની ચાલુથાપણો ઘટે છે અને સરકારની થાપણો વધે છે . પરિણામે થાપણોનું કુલ પ્રમાણ યથાવત્ રહે છે . પણ જેટલા પ્રમાણમાં લોકોની ચાલુ થાપણો સરકારની માલિકી હેઠળ આવે છે તેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો ઘટે છે . જો સરકાર પોતાની થાપણો વેપારીબેંકોમાંથી ઉપાડી મધ્યસ્થ બેંકમાં મૂકે તો તેટલે અંશે વેપારીબેંકોની થાપણોમાં અવશ્ય ઘટાડો થશે .

ધારો કે સરકારની થાપણો (G) સામે પણ વેપારીબેંકો ચોક્કસ રોકડ - અનામત પ્રમાણ (rG) રાખે છે અને સરકારની થાપણો અને લોકોની ચાલુ - થાપણો વચ્ચે ચોક્કસ ગુણોત્તર (g) છે . આથી નાણાંસર્જનને પરિણામે વેપારી બેંકોમાં ૧૦૦ રૂ . નો વધારો થતાં સમીકરણ (૮) મુજબ ચાલુથાપણ (અને તેથી નાણાંની પુરવઠામાં) જેટલો વધારો થાય છે એની સરખામણીમાં હવે બેંકથાપણનો વધારો ઓછો હશે .

પાન નં ૨૩

૧૧ . નાણાંપુરવઠાનો ગુણક :

નાણાંપુરવઠાના સમીકરણમાં છેદમાં દર્શાવવામાં આવેલાં ઘટકો (C' , rD , e , rTt , rGg) અર્થતંત્રના ચાર ક્ષેત્રોના નિર્ણયો અને પ્રવૃત્તિઓની અભિ - વ્યક્તિ છે : (૧) વ્યક્તિઓ કે કુટુંબો અને ખાનગી પેઢીઓ , (૨) વેપારીબેંકો , (૩) મધ્યસ્થ બેંક અને (૪) સરકાર .

દા . ત . , વ્યક્તિઓ કે કુટુંબો અને પેઢીઓના નિર્ણયો દ્વારા ચલણીનાણાં અને ચાલુથાપણોનો ગુણોત્તર (c') તેમજ મુદતી થાપણ અને ચાલુથાપણોનો ગુણોત્તર (t) નક્કી થાય છે . ચાલુથાપણ તેમ જ મુદતીથાપણ સામે વેપારી બેંકોમાં

લઘુત્તમ રોકડઅનામત પ્રમાણ (rD અને rT) નક્કી કરવાની સત્તા મધ્યસ્થબેંક પાસે છે , જ્યારે અતિરિક્ત રોકડ અનામત પ્રમાણ (e) વેપારીબેંકો પોતે નક્કી

કરે છે . સરકારની થાપણો અને ખાનગી ચાલુથાપણોનો ગુણોત્તર (g) ટ્રેઝરી દ્વારા નક્કી થાય છે .

જો નાણાંપુરવઠાનો પાયો સ્થિર હોય તો , નાણાંપુરવઠાના ગુણકમાં વધારો થતાં નાણાંને પુરવઠો વધી જશે અને નાણાંપુરવઠાના ગુણકમાં ઘટાડો થતાં નાણાંનો

પાન નં ૨૪

પુરવઠો ઘટી જશે . વાસ્તવમાં c' , e , t , અને g સ્થિર નથી . ગદા . ત . , વેપારી

સંજોગો બદલાય કે વ્યાજના દરમાં ફેરફાર થાય તો c' અને t માં ફેરફાર થશે . વ્યાજના દરમાં થતા ફેરફારની e પર પણ અસર પડે છે . વેપારી બેંકોમાં લોકોને કેટલો વિશ્વાસ છે એ હકીકતની પણ c' અને e પર અસર પડે છે અને સર - કારની આવક અને તેના ખર્ચના ઋતુગત ફેરફારોની g પર અસર પડે છે . મધ્યસ્થબેંક આદેશાત્મક કાયદા દ્વારા rD અને rT માં ફેરફાર કરે છે : પણ એ ફેરફાર નજીવા પ્રમાણમાં અને જવલ્લે જ કરવામાં આવે છે .

*

-